



**LESHA INDUSTRIES**  
L I M I T E D

**August 12, 2023**

To,  
**Department of Corporate Services**  
**BSE Limited**  
Ground Floor, P. J. Tower,  
Dalal Street, Fort,  
Mumbai- 400 001

Security ID: LESHAIND  
Security Code: 533602

**Sub: Copy of Advertisement of Unaudited Financial Results for the Quarter ended on June 30, 2023.**

Dear Sir/Madam,

Please find enclosed herewith copy of Advertisement of Unaudited Financial Results for the Quarter ended on June 30, 2023 as per the Regulation 47(1) (b) and 47(3) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 published in one English daily newspaper and one daily newspaper in the language of the region, where the registered office of the company is situated.

Please take the same on your record.

Thanking You,

Yours faithfully,

**For Lesha Industries Limited**

**Ashok C. Shah**  
**Managing Director**  
**DIN: 02467830**



Encl: As above

7th Floor, Ashoka Chambers,  
Mithakhali Six Roads,  
Ahmedabad - 380 006.  
Phone : +91 - 79 - 26463227  
Web : [www.lesha.in](http://www.lesha.in)  
E-mail : [info@lesha.in](mailto:info@lesha.in)  
CIN: L27100GJ1992PLCO18607

## Libraries have been considered a symbol of the collective consciousness and intellect of a country or society- President Smt. Droupadi Murmu



The President of India, Smt. Droupadi Murmu inaugurated the unique 'Festival of Libraries' in New Delhi today. This Festival has been organized by the Ministry of Culture with the aim to promote the development and digitization of Libraries and cultivate the culture of reading. Speaking on the occasion, the President said that such incidents do not happen in the modern era but there are incidents of disappearance of rare manuscripts and books. She said that efforts can be made to bring back rare books and manuscripts. The President said that libraries are as a bridge between civilizations. In ancient and medieval periods, people of many countries carried books from India, translated those and gained knowledge. At the heart of such efforts is the thought that books and libraries are the common heritage of humanity. The President said that a small book has the potential to change the course of world history. She referred to Gandhiji's autobiography, where he has mentioned about the great positive impact of John Ruskin's book 'Unto This Last' on his life. She said that books contain in them the fragrance of the land and the vastness of the sky. Minister of State for Culture and Law and Justice Shri Arjun Ram Minister and Minister of State for Culture and External Affairs, Smt. Meenakshi Lekhi and Secretary, Culture Shri Govind Mohan were also present on the occasion. Speaking on the occasion Shri Meghwal said that Festival of Libraries is a step towards the goal of making India a knowledge superpower of the world in 21st Century. Smt. Meenakshi Lekhi spoke about the government's commitment to reach every corner of the country, furthering the Prime Minister's vision for library development and encouraging a culture of reading. "The 'Festival of Libraries 2023' plays a pivotal role in this mission, fostering inclusivity and ensuring access to information for all citizens. By celebrating the diversity of knowledge and encouraging reading habits, the festival paves the way for a more informed and empowered society, nurturing a thirst for learning and inspiring progress across the country," she further added. According to the Joint Secretary of the Union Ministry of Culture, Ms. Mugha Sinha "The festival aims to initiate a dialogue on the modernization and digitization of libraries and ignite a resurgence of the reading culture in India. By facilitating advocacy for action-oriented policies, the festival seeks to develop model libraries even at the village and community levels, ensuring that knowledge and literacy are the 'book and corner of the nation'." Day 1 of the 2023 Festival of Libraries in India witnessed numerous significant milestones, all centered around the advancement of knowledge and libraries in the

encouraging readership and promoting visits to various libraries across India, too was launched on day 1 of the festival. Furthermore, to enhance readers' convenience, the Biblio-on-Demand service was launched, offering prompt access to any desired book. Day one concluded with the Virtual Groundbreaking Ceremony of Delhi Public Library's modernisation, demonstrating a strong commitment to improving user experiences and modernising the Delhi Public Library.

The President of India, Smt. Droupadi Murmu graced and addressed the 165th convocation of University of Madras in Chennai. Speaking on the occasion, the President said that founded in the year 1857, the University of Madras has the distinction of being one of the oldest modern universities in India. This university has played a critical role in dissemination of knowledge. Throughout its journey of over 165 years, University of Madras has adhered to high standards of academics, providing an environment that fosters intellectual curiosity and critical thinking. It has been a cradle of learning, producing countless scholars, leaders, and visionaries. It has also served as a lighthouse, playing a pivotal role in the establishment and growth of many reputed universities in the southern region of India. Referring to the rich history and glorious legacy of the University of Madras, the President said that the alumni of this institution can play a significant role in its growth as a global centre of excellence. They can mentor the young students. She added that the University should also reach out to the alumni to seek their cooperation for the betterment of the institution. The President noted that the University of Madras has promoted a culture of research and academic rigor. She urged the University of Madras to invest more in cutting-edge research, encourage inter-disciplinary studies, and promote international collaborations. The University of Madras should be at the forefront of finding learning-based solutions to the problems being faced by the nation and the world at large. The President said that in today's highly competitive environment, the pressure to excel in academics, the fear of not getting into good institutions, the anxiety of not landing a prestigious job, and the weight of expectations from the parents and the society are causing acute mental stress amongst our youth.

## PRESIDENT OF INDIA GRACES 165TH CONVOCATION OF UNIVERSITY OF MADRAS

**LESHA INDUSTRIES LIMITED**  
Registered Office: 7th Floor, Ashoka Chambers, Mithakhali Six Road, Ahmedabad 380 006.  
CIN: L27100GJ1992PLC018607

**UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2023**  
(Rs. In Lakhs)

Particulars	Quarter ended	Previous Year ended	Corresponding 3 months ended in the previous year
	30-06-2023	31-03-2023	30-06-2022
	Unaudited	Audited	Unaudited
Total income from operations	75.28	690.66	283.67
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	7.18	17.22	36.53
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	636.92	17.22	36.53
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	631.77	19.45	33.79
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	631.77	19.45	33.79
Equity Share Capital	1100.00	1100.00	1100.00
Earnings Per Share (before extraordinary items) (of Rs. 1/- each) (not annualised)			
Basic	0.57	0.02	0.03
Diluted	0.57	0.02	0.03
Earnings Per Share (after extraordinary items) (of Rs. 1/- each) (not annualised)			
Basic	0.57	0.02	0.03
Diluted	0.57	0.02	0.03

Notes:  
The above is an extract of the detailed format of Quarterly/Yearly Financial Results filed with stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Yearly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the company's website (www.lesha.in)

For, LESHIA INDUSTRIES LIMITED  
SD/-  
Ashok C. Shah  
Managing Director  
DIN: 02463730

Date: 10/08/2023  
Place: Ahmedabad

**GOKUL AGRO RESOURCES LIMITED**  
CIN: L15142GJ2014PLC080010  
Registered Office: Crown-3, Inspire Business Park, Shantigram, Nr Vaishnoveji Circle, S.G. Highway, Ahmedabad-382421 Gujarat, India  
E-Mail ID: compliances@gokulagro.com; Tel No: +91 79 67123500; Website: www.gokulagro.com

**EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE FIRST QUARTER ENDED ON 30TH JUNE, 2023**  
(Rs. in Lakhs except EPS)

SN	Particulars	Quarter Ended	Year Ended	Quarter Ended
		30 <sup>th</sup> June, 2023	31 <sup>st</sup> March, 2023	30 <sup>th</sup> June, 2022
		Unaudited	Audited	Unaudited
1	Total Income from Operations	2,46,886.39	10,73,980.75	2,86,386.09
2	Net Profit for the period (Before Tax, Exceptional and/or Extraordinary Items)	3,145.80	17,473.61	3,722.15
3	Net Profit for the period Before Tax (After Exceptional and/or Extraordinary items)	3,145.80	17,473.61	3,722.15
4	Net Profit for the period After Tax (After Exceptional and/or Extraordinary items)	2,404.76	13,240.69	2,826.84
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive income (after tax)]	2,438.17	13,919.49	3,101.31
6	Equity Share Capital (Face value of Rs. 2/- each)	2950.87	2,950.87	2861.45
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	62,109.99	-
8	Earnings Per Share (of Rs. 2/- each) (for continuing and discontinued operations)			
	1. Basic:	1.63	9.18	1.96
	2. Diluted:	1.63	9.18	1.96

Notes:  
1. The aforesaid Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their Meeting held on August 10, 2023.  
2. Additional Information on Standalone Financial Results is as follows:

SN	Particulars	Quarter Ended	Year Ended	Quarter Ended
		30 <sup>th</sup> June, 2023	31 <sup>st</sup> March, 2023	30 <sup>th</sup> June, 2022
		Unaudited	Audited	Unaudited
1	Total Income from Operations	2,35,750.45	10,08,281.97	2,59,039.36
2	Turnover	2,33,197.29	10,05,783.35	2,58,263.73
3	Net Profit for the period (Before Tax Exceptional and/or Extraordinary items)	2,415.21	14,141.01	2,955.04
4	Net Profit for the period Before Tax (After Exceptional and/or Extraordinary items)	2,415.21	14,141.01	2,955.04
5	Net Profit for the period After Tax (After Exceptional and/or Extraordinary items)	1,800.41	10,470.45	2,192.22

3. The above is an extract of the detailed format of Unaudited Standalone and Consolidated Financial Results for the first quarter ended on June 30, 2023 available on Stock Exchange website www.bseindia.com (Scrip Code-539725) and www.nseindia.com (Scrip Symbol-GOKULAGRO). The same are also available on the Company's website viz. www.gokulagro.com.

For & on behalf of Board of Directors of  
Gokul Agro Resources Limited  
SD/-  
Jayesh Thakkar  
Managing Director (DIN : 03050068)

Place: Ahmedabad  
Date: 10th August, 2023

**SUNGOLD CAPITAL LTD**  
(CIN: L65910G11993PLC018956)

Regd. Off: Ground Floor, 36, Shri Rang Residency, Vadia, Rajpipla, Narmada, Gujarat - 393145.  
Corporate Off: B/618, 6th Floor, Jaswanti allied Business Centre, off: Ramchandra Lane extn, Malad (west), Mumbai - 400064 • Website: www.sungoldcapitallimited.com  
Email: info@sungoldcapitallimited.com • sungold2006@gmail.com

**STATEMENT OF UNAUDITED FINANCIAL RESULT FOR THE QUARTER ENDED JUNE 30, 2023**  
(Rs. In Lakhs, except per share data)

Sr. no.	Particulars	Quarter ended	Year to date Figures/Previous Year ending	Corresponding Three months ended in the previous year
		30-06-2023	31-03-2023	30-06-2022
		Unaudited	Audited	Unaudited
1	Total Income from Operations	67.167	179.696	46.161
2	Net Profit / (Loss) for the period (before Tax (after Exceptional and/or Extraordinary items))	3.491	3.520	3.253
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	3.491	3.520	3.253
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	3.271	2.633	3.048
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	3.271	2.633	3.048
6	Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each)	1840.350	1840.350	1840.350
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	367.084	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -			
	(a) Basic	0.018	0.014	0.017
	(b) Diluted	0.018	0.014	0.017

NOTES:  
The above result is reviewed by the Audit Committee at the meeting and approved by the Board of Directors at their meeting held on Friday, August 11, 2023. The statutory auditor of the company has carried out "Limited Review" of the Financial Results for the quarter ended June 30, 2023. The above is an extract of the detailed format of financial result filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations, 2015. The full format of financial result is available on Stock Exchange website www.bseindia.com and on Company's website: www.sungoldcapitallimited.com. The Company has three reportable segments, which are NBF, Entertainment and Software Development.

For Sungold Capital Limited  
SD/-  
Rajiv Kotia  
(Chairman & Managing Director)  
DIN: 00155912

Place : Rajpipla  
Date : 11-08-2023

**PARKER AGROCHEM EXPORTS LIMITED**  
(CIN: L24110G11993PLC021012)  
Registered Office: Block H, Plot 3 & 4, New Kandla - 370 2710 (Kutch)  
Corporate office: 401, 4th Floor, Turquoise Building, Panchnathi Five Roads, Ahmedabad-380006 (Gujarat)

**UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2023**  
(Rs. in Lacs)

Particulars	Quarter ended on 30-06-2023	Quarter ended on 30-06-2022	Year ended on 31-03-2023
	(Unaudited)	(Unaudited)	(Audited)
Total income from operations	102.20	94.53	435.83
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items #)	10.99	(6.34)	65.27
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items #)	10.99	(6.34)	65.27
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items #)	10.99	(6.34)	65.27
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	10.99	(6.34)	65.27
Equity Share Capital	477.90	477.90	477.90
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	-	(176.17)
Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -	0.23	(0.13)	1.37
(a) Basic & (b) Diluted			

Notes:  
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015.  
2. The full format of the Quarterly Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com) and on the website of the Company (www.parkeragrochem.com).

By Order of the Board,  
For PARKER AGROCHEM EXPORTS LIMITED  
SD/-  
JAGDISH R. ACHARYA (DIN No. 01251240)  
CHAIRPERSON & MANAGING DIRECTOR

PLACE: AHMEDABAD  
DATE: 11th August, 2023

**ECS Bitech Limited**  
CIN : L30007GJ2010PLC063070  
Registered Office : B-02, THE FIRST, ECS Corporate House, Behind Keshavnagar Party Plot, Off 132 Ft. Road, Vastapur, Ahmedabad - 380015, Gujarat.  
Phone : +91-8980005048 | E-mail : secretarial@ecscorporation.com | Website: www.ecscorporation.com

**Extract of Un-audited Standalone Financial Results for the Quarter ended on 30th June, 2023**  
(Rs. in Lakhs)

Sr. No.	Particulars	Standalone			
		Quarter ended 30-06-2023	31-03-2023	30-06-2022	Year Ended 31-03-2023
		Un-audited	Audited	Un-audited	Audited
1	Total Income from operations	42.44	29.67	31.30	119.97
2	Other Income	2.31	4.43	6.36	14.41
3	Total Income (1+2)	44.75	34.10	37.65	134.38
4	Profit before Exceptional Items and Tax	1.59	(2.57)	1.03	1.90
5	Profit before Tax	1.59	(2.57)	1.03	1.90
6	Net Profit for the period	1.59	15.97	1.03	20.44
7	Total Comprehensive Income for the period	-	-	-	-
8	Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each per Share)	2,055.50	2,055.50	2,055.50	2,055.50
9	Earnings Per Share (EPS) of Rs. 10/- each (Not Annualised)				
	1. Basic (Rs.)	0.01	0.08	0.00	0.10
	2. Diluted (Rs.)	0.01	0.08	0.00	0.10

Notes:  
1. The above Un-audited Standalone financial results for the Quarter ended 30th June, 2023 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meetings held on 11th August, 2023 and the Limited Review of the same has been carried out by the Statutory Auditors of the Company.  
2. The above is an extract of the detailed format of Standalone Un-audited Financial Results for the Quarter ended on 30th June, 2023 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Un-audited Standalone Financial Results for the Quarter ended on 30th June, 2023 are available on the Stock Exchange website: www.bseindia.com and on the Company's website: www.ecsbitech.com.

For and on behalf of the Board  
SD/-  
Vijay M. Mandora  
Managing Director  
(DIN: 00328792)

Date: 11-08-2023  
Place: Ahmedabad

